



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૬/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૯૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૪ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૧૮૫ લીટર દેશી દારૂ, ૦૪ બીયરટી અને ૧ એક્ટીવા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૬,૨૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૯૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૮ વ્યક્તિઓની અને પ્રોહી.૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૯૭/૧૯

વાસણા : રમેશકુમાર ભવાનીશંકર જોષી (ઉ.વ.૬૬)(રહે.હરીહરાનંદ સોસાયટી, મલાવ તળાવ રોડ, જીવરાજપાર્ક) એ તા.૧૦/૬/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૪/૨૦૧૭ થી તા.૨૦/૧૦/૨૦૧૮ દરમ્યાન પોતાના ઘરે આરોપી ઉજાલા કેડીટ કો.ઓ.સો.લી. ના ચેરમેન (૧) તુષારભાઈ રમેશભાઈ પ્રજાપતિ (રહે.ગીરીપાર્ક સોસાયટી, ડોન બોસ્કો સ્કુલ પાસે, જીવરાજપાર્ક) અને (૨)ગુજરાત હેડ પ્રદીપભાઈ પટેલ (રહે.હિમ્મતનગર, સાબરકાંઠા) એ ભેગામળી રમેશકુમાર તથા તેમની પત્નિ અને તેમની દિકરીને કેડીટ સોસાયટીમાં થાપણ જમા કરાવી ઉંચા વ્યાજ દરની ચૂકવણી કરવાની લાલચ આપી, તેમની પાસેથી કુલ રૂપિયા ૧૯,૧૫,૦૦૦/- મેળવી લઈ, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ વુ.પો.સ.ઇ.શ્રી યુ.આર.ભટ્ટ ચલાવે છે.

ધરફોડ :-

સમાચાર યાદી નં.૯૯૮/૧૯

એરપોર્ટ : ઇશ્વરભાઈ જેસીગભાઈ સોની (ઉ.વ.૫૬)(રહે.બાપા સીતારામ મદીરની સામે સમરથનગર સરદારનગર) એ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૬/૨૦૧૯ રાતના ૧૧/૩૦ થી તા.૧૦/૦૬/૧૯ ના કલાક ૪/૨૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના મેઇન દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી સોનાનું મંગળસુત્ર, હાથના કંગન, સોનાની બંગડી નંગ-૨, સોનાની ચેઇન નંગ-૩, સોનાની વીંટી નંગ-૮, તથા રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- અને મોબાઇલ ફોન નંગ-૨ તથા અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂપિયા ૫,૭૮,૫૦૦/- મતાની ચોરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પ્રજાપતિ ચલાવે છે.

પાણીની ટાંકીમાં પડી જતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૯૯૯/૧૯

સરદારનગર : સુમિત સ/ઓ સંદીપ પાસવાન (ઉ.વ.૦૩)(રહે.કૈલાશભાઈ મારવાડીના મકાનમાં ખોડીયારનગર વિભાગ-૩ વૈશાલી સ્કુલ પાસે નોબલનગર) તા.૦૯/૦૬/૨૦૧૯ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે આવેલ પાણીની ટાંકીમાં રમતા-રમતા પડી જતા, ડુબી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડૉક્ટર શ્રીએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી જયેન્દ્રસિંહ લાલસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૦૦/૧૯

ખોખરા : ફેકલીંગ ફીલીપભાઈ કીશ્વન (ઉ.વ.૪૧)(રહે.નાઝરથા કોલોની જય સોમનાથ સ્કુલ પાસે ખોખરા) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૬/૨૦૧૯ રાતના ૧૦/૩૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે લોખંડ ની એંગલ તથા વાસની વળીથી બનાવેલ પતરા ના સેડવાળી જગ્યાએ વાસ સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.વાઘેલા ચલાવે છે.

ગુજરાત યુનિવર્સિટી : નારણભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૨૮)(રહે.મોડાદેવાનો વાસ ગુલબાઈ ટેકરા) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૬/૨૦૧૯ રાતના ૧૦/૦૦ થી તા.૧૦/૬/૧૯ સવારના ૭/૪૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે મોભના લાકડે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.